

Date: 17.09.2024

To,
BSE limited
Department of Corporate Services
P J Towers, Dalal Street,
Mumbai - 400001.
Security Code : 514280

Dear Sir/Madam,

Subject : Submission of newspaper advertisement in respect of Corrigendum to the Notice of AGM for change in record date and book closure.

Pursuant to Regulation 47 of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015, we enclose herewith the copies of the newspaper advertisement published in respect of Corrigendum to the Notice of AGM for change in record date and book closure for your information.

Kindly take the same on your record.

Yours Faithfully,

For, Sanrhea Technical Textiles Limited



Dharmesh Patel
(Company Secretary)



Editorial

Editor : Mayur Bhatt

"Those who work the Disaster Management way, live to work another day."



Vinod Chandrashekhar Dixit
Free-lance Journalist, Writer & Cartoonist
(dixitpatrakar@yahoo.in)

"Worrying about the past or the future isn't productive. When you start chastising yourself for past mistakes, or seeing disaster around every corner, stop and take a breath and ask yourself what you can do right now to succeed." Harvey Mackay

"Disaster means catastrophe, mishap, calamity or grave occurrence in any area, arising from nature or man-made causes, or by accident or negligence which result in substantial loss of life, of human suffering or damage to, and destruction of property, or damage to, or degradation of environment, and is of such nature or magnitude as to be beyond the coping capacity of the community of affected areas."

According to the statistics, 68% of India's land is prone to drought, 60% to earthquakes, 12% to floods and 8% to cyclones, making India one of the most disaster prone countries in the world, affecting overall 85% of Indian land and more than 50 million people.

Disaster Management is the regulation of dealing with and avoiding risks. It involves preparing for a disaster before it happens. Disaster management is yet to be seen as an essential part of good governance and integral to development planning. It occupies an important place in India's policy structure as it is poor and the under-privileged who are worst affected on account of calamities/disasters.

Every year, we experience some natural disaster but we have no strategy to alleviate its effects. Natural disasters are no doubt, beyond human control. It is observed that from the natural calamities happening we haven't learnt lessons from them. Damage to the ecology wreaked by deforestation and construction of dams has been the core cause of such a massive disaster. India is becoming a breeding ground for natural calamities and it is high time that we formulated some plans to go green in the

country by reducing mounting pollutants.

We all know that disasters are not exodus from the normal functioning of societies. Rather, they often illustrate the model, and aggravate the potential of a perilous event. Understanding the complexity characteristics of any given disaster management catchment, and devising institutional cultures to counter them is key to building effective institutions.

Disaster Management is an effort to inquire into the process of a hazard turning to disaster to identify its causes and rectify the same through public policy. It is a policy issue concerned with minimizing and preventing the damaging impact of a natural or manmade hazard.

Business interruptions can occur anywhere & at any time. It is impossible to predict what may strike when and therefore it has become binding to prepare for such disaster scenarios. Disaster risk management is a critical, if couched, factor in daily decision-making. A variety of risk financing and other financial tools have been developed to facilitate management of risks. A disaster disrupts business activities on which the local population depends, affecting livelihood recovery and means to earn a living. This is particularly true when new skills are needed for new types of jobs.

Stout financing tools can help the poor to break the poverty cycle by protecting their development gains, reducing impacts and losses of disaster shocks. It is observed that risks from injury, sickness or disaster are a critical dimension of poverty and can easily threaten the small savings and fragile livelihoods of poor families. Further, disasters are not departures from the normal functioning of societies. Rather, they often exemplify the norm, and exacerbate the potential of a hazardous event.

Understanding the patterns in human social dynamics in any given region is therefore an important key to building effective institutions. Some disasters are unique events - rare, unpredictable acts - for which rational responses are difficult. Others are discrete; they are results of correctable factors such as a failure of a component, limited design error, or a mistake by an operator.

Understanding the complexity characteristics of any given disaster

management catchment, and devising institutional cultures to counter them, is therefore a second key to building effective institutions.

There should be systematic resort to "disaster drills" to educate the public on what to do during an earthquake. Preparedness is the key to managing any more such disasters.

Although a 2005 law on disaster management has been put into effect at the national level, it exists only on paper in a few states and districts. A national disaster response force was also formed for rescue and evacuation.

It is an unfortunate reality in the age of highly hazardous industry that accidents are bound to happen. It is however the responsibility of all sectors of society to ensure that we are prepared to cope with the aftermath. Disaster management is like breathing, if you don't, you die.

Disaster preparedness starts with 'D' but begins with 'YOU'. If we need to change anything, it has to start from our home. As we know that our family may not be together when all off a sudden a disaster strikes, it is important to create a plan in advance. One must find reliable information sources, warning systems and alert systems in advance.

Family communication is one of the most important. We may have to evacuate at a moment's notice and take essentials with us as we will have no time to search for the supplies we need or shop for them. Disaster can take place anywhere and at any time. It is important to know what to do and have a plan before a disaster strikes. Disaster preparedness measures can significantly reduce the shock of disasters on people's lives, livelihoods and assets. It is therefore necessary that to survive the disaster, every family must take responsibility for their own disaster preparedness from Home itself. People talk about business continuity plan during a disaster, natural disaster insurance, socio-economic effects of a disaster, the preparedness on the national level, and so on. We all know that it is impossible to avoid disasters, but it isn't impossible to plan ahead of time so that we can minimize the impact that any given disaster might have on us or on our family's health, safety and property. One must remember that the future belongs to those who prepare.

The biggest concern is the attitude of policy makers, implementers and local government towards investing in people-oriented preparedness at different levels. There is a growing need to look at disasters from a development perspective. Disasters can have devastating effect on communities and can significantly set back development efforts to a great extent. Disaster prevention, mitigation, preparedness and relief are four elements, which contribute to and gain from the implementation of sustainable development. The need of the hour is to chalk out a multi-pronged strategy for total disaster management comprising prevention, preparedness, response and recovery on the one hand and initiate development efforts aimed towards risk reduction and mitigation on the other cities.

For India, preparedness will have to begin with the updating of construction norms for quake-proofing. Then, inspection of all construction, old and new, must be made a priority to check for adherence. In old buildings, measures to address vulnerability, such as retro-fitting with steel structures, have to be implemented compulsorily. Lessening the potential damage, as much as responding to a disaster, needs to be part of India's disaster management strategy. We need to accept earthquakes as a reality and do everything in our power to redefine development plans, especially in terms of building quake-resistant buildings. There should be systematic resort to "disaster drills" to educate the public on what to do during an earthquake.

Preparedness is the key to managing any more such disasters. There have been many cases where there has been a relief and rescue mobilization but by the time the teams reach the damage would have already been done. Disasters are episodic but are recurrent. Therefore, it is rightly said that "Those who work the Disaster Management way, live to work another day. Safety is a race we can all win. Preparedness is the only key to the success of Disaster Management Plan and without citizens' involvement and participation any effective plan is rendered ineffective. (B-15 Jyoti Kalash Society, Jodhpur Tekra, Satellite, Ahmedabad - 380 015)

96% Of Indian midmarket businesses are already prioritising Gen AI

Ahmedabad, At SAP Now, the second flagship customer event in India this year, SAP unveiled new midmarket AI research revealing 96% of Indian organizations with between 250 and 1,500 employees are prioritising generative artificial intelligence (Gen AI), compared to 91% in the rest of the world.

The survey questioned 12,003 businesses around the world including 800 in India. Commenting on the research, Manish Prasad, President, and Managing Director of SAP Indian Subcontinent, said, "India's midmarket businesses are the backbone of the nation's economy. AI is a game-changer for these companies, offering agility, actionable insights, and helping them thrive in a digital economy. Working with a technology partner like SAP is

critical because AI is already built into our applications that power the most critical business processes. Only then can Indian businesses of every size make the promise of Business AI a reality." Rajeev Singh, Vice President and Head of Midmarket, SAP Indian Subcontinent, further added, "AI has the potential to empower organizations with intelligent insights, automation, and tools, allowing them to compete on a global scale. Today, more than 27,000 customers globally are already using SAP Business AI, recognizing the impact on enhancing operations and enabling real-time decision-making. For example, Indian customers like PGP Glass, Suzlon Energy and many more have already embraced the transformative potential of AI in their businesses." (19-10)

Mercedes-Benz rolls out its second 'Made in India' BEV

Ahmedabad, India's most desirable luxury carmaker Mercedes-Benz today made two significant announcements for the Indian luxury car market. The company with the Three-Pointed Star further strengthened its BEV portfolio in India by launching a world-class BEV that combines luxury and technology in a futuristic and progressive SUV proportion: the EQS SUV 580 4MATIC. With the EQS SUV 580 4MATIC, Mercedes-Benz offers six BEV across the portfolio comprising the EQA, EQB, EQE SUV, EQS SUV, EQS sedan and the ultra-luxury Mercedes-Maybach EQS SUV 680. With the EQS SUV, Mercedes-Benz remains on track of implementing its strategy of accelerating to a 'sustainable and digital future' faster, with a strong BEV portfolio, as more customers explore BEV adoption in the luxury segment. Mercedes-Benz also announced



the start of local production of the EQS SUV 580 4MATIC from its state-of-art manufacturing facility in Chakan, Pune. India becomes the first market outside USA, to start the local production of the EQS SUV 580, anywhere in the world. The EQS SUV 580 4MATIC will be the second locally manufactured BEV in India from Mercedes-Benz after the EQS 580 luxury sedan. Mercedes-Benz accomplishes the distinction of being the only luxury car manufacturer in India, to locally produce two world-class BEVs from its production facility. (1-7)

Decoding Rahul Gandhi's US trip: Why is India's LoP giving ammo to Khalistanis, meeting Ilhan Omar?

Rahul Gandhi has gone to the United States and whipped up a storm back home. Two days have passed in his three-day trip, and already he has given BJP a bagful of ammunition to target him. During an interview with Edward Luce, the Washington DC-based Financial Times columnist and a Modi biter whose unabashed fawning perhaps made even Rahul cringe in discomfort, India's Leader of the Opposition made a series of controversial remarks that are unmoored from facts and represent rank distortion of reality. But that's not the only occasion where he made such comments.

Rahul's itinerary also included a diaspora event in Virginia, addressing students at University of Texas in Dallas and meeting American lawmakers, members of think tanks and media persons in Washington DC. The programme was drawn up by Sam Pitroda, chairman of the Indian Overseas Congress. These foreign jaunts are meant to serve a very specific purpose for Rahul.

Long at the receiving end of a sustained campaign from the BJP about the lack of his intellectual acumen, Rahul and his advisors have figured out a way to combat the pejorative image of a simpleton. The idea is that India being a post-colonial society, these foreign trips and hobnobbing with western intellectuals and members of academia will somehow elevate Rahul's image back home and project him as a 'thinker'. Sam certainly believes so. Problem is, despite extensive tutorials on possible talking points, Rahul frequently exceeds his brief and conflates foreign platforms with domestic campaign trail. Discrediting Indian democracy while abroad, castigating India's electoral process, belittling Indian institutions, projecting India as a deeply unequal society or mocking the prime minister before students at a foreign university may generate a few claps among the audience and headlines back home, but the behaviour is not only unbecoming of a senior politician who aspires for the top job, but immature and improper for the holder of a statutory post such as the LoP. This isn't, of course, to say that India is without its share of problems. Levelling unhelped allegations and projecting domestic political rivalries on foreign soil, however, doesn't solve India's problems, make India look strong or a mature democracy. It makes us look weak, divisive, and provides a handle to India's adversaries, unless that is the plan.

India's democracy and electoral system is dynamic, robust and thriving. We are an oasis of democracy in a tough neighbourhood. India's institutions, despite myriad challenges, are performing

better than many of its western counterparts. In America, where Rahul was busy denigrating India, a former president was the target of an elaborate warfare by political rivals to stop him from running for office. The Democrats weaponised the judiciary and dragged Trump through lower courts via trumped up charges before the plan was busted by the US Supreme Court.

Rahul should introspect. His party ran an insidious, relentless campaign against the reliability of India's EVM system ahead of the 2024 general elections but miraculously all charges evaporated into thin air when it emerged that Congress has improved its tally. There is a limit to chicanery.

While in America, Rahul cast aspersions on the sanctity of India's electoral process, without providing any proof, and sought to undermine India's autonomous institutions such as the Election Commission and even the judiciary. It was a torrent of misinformation and half-truths from the Leader of the Opposition. He claimed that the BJP has "captured all institutions", which seemed more of a self-projection from the leader of a party that made it a standard operating procedure to fill every institution with party loyalists, cronies and apparatchiks in its six-decade reign since the Independence and developed an intricate patronage-based network to run the administrative system.

While speaking to Luce, Rahul alleged that the BJP is out to "destroy the Constitution". It was ironic coming from the leader of a party that inflicted Emergency on India, the only time since

Independence that India's democratic credentials have taken a hit. And it was more than a little paradoxical to hear Rahul was eloquent on Indian Constitution.

WESTERN RAILWAY-BHAVNAGAR DIVISION

E-auction for leasing contract of SLRs & VPs compartments
The Office of Sr. Divisional Commercial Manager, Western Railway, Bhavnagar Para Division, First Floor, Commercial Department, DRM Office, Gadhechi Vadla, Near RTO Circle, Bhavnagar Para, Bhavnagar, Gujarat - 364003. File No. C.78/1/36/E-Auction file Date 11/09/2024. The Divisional Railway Manager (Commercial), Western Railway, Bhavnagar Para invites e-Auction for leasing contracts of SLRs & VPS compartment of various trains originating from BVP division through IREPS. The auction has been published on IREPS website details are as follows:-

Notice Inviting e-Auction					
Type of contract : Leasing of Parcel		Catalogue No. : LEASE-2024-11			
Location & Asset details					
Auction for the Contract to award lease contract of 04 tonnes parcel space of SLRs:-					
Sr.No.	Train No.	Comp.	Frequency	From	To
1	12905	F/II SLR	Bi-Weekly	PBR (Porbandar)	SHM (Shalimar)
2	12905	F/II SLR	Bi-Weekly	PBR (Porbandar)	SHM (Shalimar)
3	11087	F/II SLR	Weekly	VRL (Veraval)	PUNE (Pune)

1. Date of e-Auction start on 25.09.2024 from 11:00 Hrs. 2. Registration on IREPS e-Auction leasing portal is required for participate in auction. 3. For more details, log in :- www.ireps.gov.in

Like us on: [facebook.com/WesternRly](https://www.facebook.com/WesternRly) Follow us on: [x.com/WesternRly](https://www.x.com/WesternRly)

Sanrhea Technical Textiles Limited

CIN: L17110GJ1983PLC006309
Registered Office: Parshwanath Chambers, 2nd Floor, Nr. New RBI, Income Tax, Ahmedabad - 380 014.
Phone No.: (02764) 252204 **E-mail:** sanrhea@gmail.com
Website: www.sanrhea.com

CORRIGENDUM TO THE 41TH AGM NOTICE OF THE COMPANY

Further to the 41th AGM Notice for the meeting of the shareholders of the Sanrhea Technical Textiles Limited (the "Company"), scheduled to be held on Monday, 30th September, 2024 at 9.00 a.m. (IST) through Video Conferencing ('VC') / Other Audio Visual Means ('OAVM'), subsequent to issuance and circulation of the 41th AGM Notice the following Corrigendum is made.

Members are requested to kindly note that the following modification is being made to relevant portion of Notes of Notice:


- In **Note No. 8** of the notes to Notice, the both dates **13th September, 2024** shall be substituted by the **20th September, 2024**;
- In **Note No. 9** of the notes to Notice, the date of Book Closure from **Saturday, September 14, 2024 to Friday, September 20, 2024 (both days inclusive)** shall be substituted by the **Saturday, September 21, 2024 and Sunday, September 22, 2024 (both days inclusive)**.

The Corrigendum of the 41th AGM Notice shall form integral part of the 41th AGM Notice dated 29.08.2024, circulated to the members of the Company. Accordingly, all the concerned shareholders, stock exchanges, depositories, Registrar and Share transfer agents, agencies appointed for E-Voting, other authorities regulator and all other concerned persons are requested to take note of the above corrections. The Corrigendum will be available on the website of the Company at www.sanrhea.com besides being communicated to BSE Limited where the shares of the Company are listed.

By order of the Board of Directors For Sanrhea Technical Textiles Limited

SD/- Dharmesh Patel Company Secretary
Place : Ahmedabad
Date : 16-09-2024

Flipkart Gears Up For 11th Edition Of 'The Big Billion Days' With New Tech Launches



Ahmedabad, Flipkart, India's homegrown e-commerce marketplace, has announced the dates for its highly-anticipated annual flagship event, The Big Billion Days (TBBDD) 2024. The shopping extravaganza will kick off on September 27 and continue till October 6, 2024, with early access for Flipkart Plus and VIP members starting September 26. As the country gears up for the festive season, The Big Billion Days 2024 promises to bring a celebration of the best deals and an exciting array of product offerings. As part of the festive preparations to cater to rising demand PAN India, Flipkart has launched 11 new fulfilment centres (FCs) across nine cities in the run up to TBBDD, bringing the total number of FCs in India to 83. This development has directly generated over 1 Lakh new jobs across its Supply Chain PAN India reflecting Flipkart's commitment to socio-economic

development, as it remains deeply focused on enabling employment opportunities. Flipkart continues to set new benchmarks in e-commerce by transforming the way India shops online during the festive season with a focus on creating growth opportunities for a wide ecosystem of stakeholders. Speaking about the 11th celebration of The Big Billion Days, Kalyan Krishnamurthy, CEO — Flipkart Group, said, "The Big Billion Days is not just a shopping event at Flipkart - it is a symbol of how digital commerce can uplift an entire ecosystem of stakeholders - from sellers, MSMEs, to D2C brands and international labels. As India's festive season begins, we remain committed to creating value for the entire nation - from customers seeking affordability to sellers and local manufacturers scaling their reach. (22-2)

Sellwin Signs USD 2 Million MoU with Secorbit FZCO



Ahmedabad, Sellwin Traders Ltd and Secorbit FZCO, UAE, have signed an MoU for a \$2 million project to develop a blockchain-based tokenization platform. The platform will enable the tokenization of equities, bonds, and real-world assets, with a focus on scalability, security, and seamless integration with existing financial and blockchain ecosystems. Sellwin Traders Ltd shall undertake the development of a comprehensive blockchain-based tokenization platform over the next 24 months, order which was received by Secorbit FZCO. The Board of Directors of the company is schedule to meet on September 25, 2024, to consider issuing bonus shares and approving a stock

split, subject to shareholder and regulatory approval. The board will also review a business proposal focused on potential synergies and forward integration to meet evolving customer needs. The company has also entered into Memorandum of Understanding with SDF Productions Pvt Ltd, an agri-export company specializing in spices, pulses, pulp, rice, tea, fruits, and vegetables. Sellwin expects revenue in excess of Rs. 30 crore from the business arrangement with a healthy margins of 35-40%. Under the MoU, Sellwin Traders Ltd will supply agro products to SDF Productions Pvt Ltd, which will then distribute these products to both Indian and international markets based on purchase orders. Sellwin will provide financial support to SDF Productions for procurement from Indian suppliers. Recently, SDF Productions secured several orders for mango pulp, including a USD 259,500 order from Ninety Nine Foodstuff Trading L.L.C., two orders totaling USD 130,200 from Shing Exim General Trading L.L.C., and additional orders from The Springs Foodstuffs Trading Co L.L.C. (18-2)

PIRAMAL CAPITAL & HOUSING FINANCE LTD.
CIN: L65910MH1984PLC032639
Registered Office: Unit No. 501, 5th Floor, Piramal Amli Building, Piramal Agastya Corporate Park, Kamani Junction, Opp. Fire Station, LBS Marg, Kuria (west), Mumbai-400070 - T: +91 22 3802 4000
Branch Office: 208-212, 2nd Floor, Turquoise, Panchvati Cross Road, C G Road, Ahmedabad-380009
Contact Person: 1. Dipnesh Rathod - 9687619755 2. Varyia Vallabhbhai - 9925827126 3. Vishal Ketele - 9584966653

E-Auction Sale Notice - Fresh Sale

Pursuant to taking possession of the secured asset mentioned hereunder by the Authorized Officer of Piramal Capital & Housing Finance Limited, under the Securitization and Reconstruction of Financial Assets and Enforcement of Security Interest Act, 2002 for the recovery of amount due from borrower/s, offers are invited by the undersigned for purchase of immovable property, as described hereunder, which is in the possession, on 'As is Where is Basis', 'As is What is Basis' and 'Whatever is There is Basis', Particulars of which are given below:

Loan Code / Branch / Borrower(s) / Co-Borrower(s) / Guarantor(s)	Demand Notice Date and Amount	Property Address -final	Reserve Price	Earnest Money Deposit (EMD) (10% of RP)	Outstanding Amount (12-09-2024)
Loan Code No.: 064000005950, Rajkot (Branch), Hardik Jagdishchandra Gokani (Borrower), Avani Hardik Gokani (Co Borrower 1)	Dt: 18-06-2020, Rs. 2525488/-, (Rs. Twenty Five lakh Twenty Five Thousand Four Hundred Eighty Eight Only)	All The piece and Parcel of the Property having an extent - Flat No.402 ashray Apartment NA Junction Plot, SI No. 11, Junction Plot, SI No. 11, Basseji Bajarang Soda Rajkot Gujarat IN 360001 Boundaries AS - North - Margin Space hereafter junction plot SI South - Passage & Stair East - Flat no.401 West - Others property	Rs. 2455000/-, (Rs. Twenty Four lakh Fifty Five Thousand Only)	Rs. 245500/-, (Rs. Two lakh Forty Five Thousand Five Hundred Only)	Rs. 4318620/-, (Rs. Forty Three lakh Eighteen Thousand Six Hundred Twenty Only)
Loan Code No.: 064000004147, Rajkot (Branch), Saliess Kanayalal Pandya (Borrower), Maya Shaleshkumar Pandya (Co Borrower 1)	Dt: 23-04-2019, Rs. 1581533/-, (Rs. Fifteen lakh Eighty One Thousand Five Hundred Thirty Three Only)	All The piece and Parcel of the Property having an extent - Flat No.101, First Floor, Sutarshan NA Apartment, Plot No.2p, Opp.janak Puri, Apartment, Plot No.2p, Opp.janak Puri, Nr. Natral, Zanzarda Road Dehlati Gujarat IN, 382001 Boundaries AS - North - Road then Open Plot South - Flat No.104 East - Internal Road West - Flat No.106	Rs. 1540000/-, (Rs. Fifteen lakh Forty Thousand Only)	Rs. 154000/-, (Rs. One lakh Fifty Four Thousand Only)	Rs. 3277495/-, (Rs. Thirty Two lakh Seventy Seven Thousand Four Hundred Ninety Five Only)
Loan Code No.: 064000006931, Rajkot (Branch), Viralkumar Valjibhai Khant (Borrower), Amrutaben Bharatbhai Patel (Co Borrower 1)	Dt: 20-07-2021, Rs. 1729857/-, (Rs. Seventeen lakh Twenty Nine Thousand Eight Hundred Fifty Seven Only)	All The piece and Parcel of the Property having an extent - Flat No A 1204, Asterish Dream 1, Nr Kesturi Residency Bh Ambika Township, Ambika Township, RAJK3807, GUJARAT, 380001 - Boundaries AS - North - Flat No. A-1203 South - Margin hereafter Tower No. 2 East - Margin space West - Flat No. A-1201	Rs. 2900000/-, (Rs. Twenty Nine lakh Only)	Rs. 290000/-, (Rs. Two lakh Ninety Thousand Only)	Rs. 2631821/-, (Rs. Twenty Six lakh Thirty One Thousand Eight Hundred Twenty One Only)

DATE OF E-AUCTION: 24-10-2024, FROM 11.00 A.M. TO 1.00 P.M. (WITH UNLIMITED EXTENSION OF 5 MINUTES EACH), LAST DATE OF SUBMISSION OF BID: 23-10-2024, BEFORE 4.00 P.M.
For detailed terms and conditions of the Sale, please refer to the link provided in www.piramal.com/finance or email us.on.piramal.auction@piramal.com

STATUTORY 30 DAYS SALE NOTICE UNDER SARAFAESI ACT TO THE BORROWER/GUARANTOR / MORTGAGEE
The above-mentioned Borrower/Guarantor are hereby notified to pay the sum as mentioned in section 13(2) notice in full with accrued interest till date before the date of auction, failing which property will be auctioned/sold and balance dues if any will be recovered with interest and cost from borrower/guarantor.
Date: 17-09-2024 **Place: Gujarat**
Sd/-(Authorised Officer)
Piramal Capital & Housing Finance Limited

